

February 1, 2021

E-FILING

To

1. The Manager, Corporate Relationship Dept.,
BSE LIMITED,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
MUMBAI – 400 001

2. The Manager, Listing Department,
NATIONAL STOCK EXCHANGE OF INDIA LTD.,
"Exchange Plaza", C-1, Block-"G",
Bandra-Kurla Complex, Bandra (E),
MUMBAI – 400 051

Script Code : 526725

NSE Symbol : SANDESH (EQ.)

Dear Sir / Madam,

Sub: Intimation to Stock Exchange regarding publication of Board Meeting Notice in Newspaper

Pursuant to Regulation 30 and 47 read with Schedule III of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of newspaper advertisement published in the newspapers i.e. "Financial Express" (English Newspaper) and "Sandesh" (Gujarati Newspaper), intimating about the Board Meeting which will be held on **Tuesday, February 9, 2021 at 5:30 p.m.** to inter alia:

- consider, approve and take on record the Unaudited Standalone & Consolidated Financial Results of the Company for the **Quarter and Nine Months** ended on **December 31, 2020**; and
- consider declaration of Interim Dividend to the equity shareholders for the Financial Year 2020-21.

Further the said notice also mentions about the closure of trading window for trading in the Equity Shares of the Company, that was already closed, in pursuance to "Code of Conduct for Prevention of Insider Trading" and "Code of Practices and Procedures for Fair Disclosure of Unpublished Price Sensitive Information", adopted by the Company under SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015.

Also, in terms of Regulation 46 of the Listing Regulations, the aforesaid notice is uploaded on the website of the Company (www.sandesh.com).

Kindly take the same on your records.

Thanking you,

Yours sincerely,
FOR, THE SANDESH LIMITED


DHAVAL PANDYA
COMPANY SECRETARY



Encl: As above

THE SANDESH LIMITED (CIN: L22121GJ1943PLC000183)

REGD. OFFICE: 'SANESH BHAVAN', LAD SOCIETY ROAD, B/H. VASTRAPUR GAM, P.O. BODAKDEV, AHMEDABAD-380054.
TEL.: (079) 40004319, 40004175, FAX: 91-79-40004242 Email: secretarial@sandesh.com, cs@sandesh.com
VIST US: www.sanesh.com

TN nod to Tata's ₹5,763-crore plan to build mobile parts unit

FE BUREAU
Chennai, January 30

THE TAMIL NADU government has cleared a proposal by Tata Electronics to set up a mobile phone components manufacturing plant in Krishnagiri district at an investment of ₹5,763 crore, which will create 18,250 jobs.

The state Cabinet, under the chairmanship of chief minister Edappadi K Palaniswami, late on Friday evening gave approval for 34 major investment proposals, including that of Tata and Pegatron Corporation of Taiwan, a contract manufacturer for Apple, which will spend ₹1,100 crore in phase-I investment and create 14,079 jobs in Chengelpet district to set up a

mobile phone manufacturing plant. The Cabinet also cleared the Tamil Nadu government's new industrial policy, 2021, which will be unveiled soon.

The 34 proposals approved involve an investment of ₹52,257 crore and has the potential to create 93,935 jobs. The investments are mostly in sectors like electronics, automobile and auto-components, including electric vehicles and solar cell manufacturing, a statement by the state government said. Some of the major investments that have been approved include that of Luxshare of Taiwan, which will pump in ₹745 crore and create 4,000 jobs to make electronic components and wearables at Sriperumbudur, reviving the

defunct Motorola factory.

Sun Edison will infuse ₹4,629 crore and employ 5,397 people in the state to produce solar PV modules. Ola Electric will put in ₹2,354 crore and create employment for 2,182 people at SIPCOT park in Bargur, Krishnagiri district, for making electric vehicles and batteries. Eickhoff Wind, a German company, will invest ₹621 crore and hire 319 people to manufacture gearboxes for wind energy production, near Chennai. This is a relocation of the production facility from China and Germany. BASF of Germany, one of the world's largest chemical companies, will invest ₹345 crore and create 235 jobs to make auto-emission catalysts in Chengalpet district.

CFMA: Over 10 MFs may go Franklin Templeton way

PRESS TRUST OF INDIA
New Delhi, January 30

URGING THE SUPREME Court to come to the rescue of people who had invested in now-closed Franklin Templeton schemes, investors' body CFMA on Saturday claimed more than 10 mutual funds (MFs) may otherwise go the same way creating an MF pandemic comparable to the US subprime crisis.

In a press release, CFMA (Chennai Financial Markets & Accountability) said the judiciary is the only hope for over three crore unitholders of various mutual fund schemes in the country, including those who had in-

vested in Franklin Templeton schemes.

Without disclosing the source of its information, to back up its claim, CFMA said it has learned that more than 10 other MFs want to put their losses on unitholders' heads and are only waiting for the Supreme Court verdict. The apex court is hearing pleas, including one filed by Franklin Templeton against a Karnataka High Court order that stopped the

fund house from winding up its debt fund schemes without the prior consent of the investors.

Franklin Templeton MF had announced closure of six debt schemes on April 23, 2020, citing redemption pressure and lack of liquidity in the bond market. Capital market regulator Sebi had subsequently asked the fund house on multiple occasions to focus on repaying the investors at the earliest.

THE SANDESH LIMITED
CIN-L22121GJ1943PLC000183
Registered Office: "Sandesh Bhavan", Lad Society Road, B/h. Vastrapur Gam, P.O. Bodakdev, Ahmedabad-380054 (Gujarat)
Phone No.:- (079) 40004000 • Fax:- (079) 40004242
Email:- investors@grievance@sandesh.com Website:- www.sandesh.com

NOTICE OF BOARD MEETING

NOTICE is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, a meeting of the Board of Directors of the Company will be held on **Tuesday, February 9, 2021, at 05:30 p.m.**, at Registered Office of the Company, inter alia, to consider, approve and take on record the **Standalone and Consolidated Un-Audited Financial Results of the Company for the Quarter and Nine months ended on December 31, 2020 and to consider declaration of Interim Dividend to the equity shareholders for the Financial Year 2020-21.** The information contained in this Notice is also available on the website of the Company i.e. www.sandesh.com and also on the website of the Stock Exchanges, where the equity shares of the Company are listed i.e. www.bseindia.com and www.nseindia.com.

Further, as per the "Code of Conduct for Prevention of Insider Trading" and "Code of Practices and Procedures for Fair Disclosure of Unpublished Price Sensitive Information" adopted by the Company under SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015, as amended, the Trading Window for trading in the Equity Shares of the Company has already been closed, till the expiry of 48 hours after the declaration of the Standalone and Consolidated Un-Audited Financial Results for the Quarter and Nine months ended on December 31, 2020, to the Stock Exchanges.

By order of the Board,
For, THE SANDESH LIMITED
Dhaval Pandya
Company Secretary

Place : Ahmedabad
Date : 30.01.2021

CLASSIFIEDS

EDUCATIONAL

LATE SHRI. VISHNU WAMAN THAKUR CHARITABLE TRUST'S

Seats are Available for Admission for A.Y. 2020-21

VIVA INSTITUTE OF TECHNOLOGY

Approved by AICTE, New Delhi, DTE, Govt. of Maharashtra State and Affiliated to University of Mumbai
☎ 77700 02544 / 98239 43103 | www.viva-technology.org

DTE Code: 3221

U.G. COURSES

First Year

- Mechanical Engineering
- Electrical Engineering
- Electronics & Telecommunication Engineering
- Civil Engineering

Direct Second Year

- Electronics & Telecommunication Engineering

P.G. COURSE

- M.E in Mechanical
- (Manufacturing Systems Engineering)
- M.C.A. (2 Years Course)

EDUCATIONAL

LATE SHRI. VISHNU WAMAN THAKUR CHARITABLE TRUST'S

Seats are Available for Admission for A.Y. 2020-21

VIVA SCHOOL OF ARCHITECTURE

Approved by CoA, New Delhi, DTE, Govt. of Maharashtra State and Affiliated to University of Mumbai
☎ 77448 71000 / 74474 91000 | www.vivaarch.org

DTE Code : 3516

B. Arch.

VIVA INSTITUTE OF APPLIED ART

Approved by AICTE, New Delhi, Directorate of Art and Affiliated to University of Mumbai
☎ 77569 37795 | www.vivaappliedart.org

DOA Code: 17

B.F.A (Applied Art)
B.F.A (Painting)

Admission form will be available in the Institute Office on all working days between 10 am to 4.30 pm
New Building, VIVA Campus, Shirgaon, Virar East, Tal. Vasai

VIVA INSTITUTE OF MANAGEMENT & RESEARCH

Approved by AICTE, New Delhi, DTE, Govt. of Maharashtra State and Affiliated to University of Mumbai
☎ 97660 28566 / 84463 43985 | www.vivaimr.org

DTE Code: 3161 → **M.M.S.**

Admission form will be available in the Institute office on all working days between 10am to 4.30pm at. Shirgaon, Virar (E) Tal: Vasai

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

Nippon India Mutual Fund
Wealth sets you free

Nippon Life India Asset Management Limited
(Formerly known as Reliance Nippon Life Asset Management Limited)
(CIN - L65910MH1995PLC20793)

Registered Office: 4th Floor, Tower A, Peninsula Business Park, Ganapatrao Kadam Marg, Lower Parel (W), Mumbai - 400 013. Tel No. +91 022 6808 7000 • Fax No. +91 022 6808 7097 • mf.nipponindiaim.com

NOTICE NO. 104

Record Date
February 05, 2021

DIVIDEND DECLARATION

Notice is hereby given that the Trustee of Nippon India Mutual Fund ("NIMF") has approved declaration of dividend on the face value of Rs. 10/- per unit in the undernoted scheme of NIMF, with February 05, 2021 as the record date:

Name of the Scheme(s)	Dividend (₹ per unit)*	NAV as on January 28, 2021 (₹ per unit)
Nippon India Banking Fund - Dividend Plan	3.2500	43.0167
Nippon India Banking Fund - Direct Plan - Dividend Plan		56.7007

*Income distribution will be done/dividend will be paid, net of tax deducted at source, as applicable.

Pursuant to payment of dividend, the NAV of the Scheme will fall to the extent of payout, and statutory levy, if any. The dividend payout will be to the extent of above mentioned dividend per unit or to the extent of available distributable surplus, as on the Record Date mentioned above, whichever is lower.

For units in demat form: Dividend will be paid to those Unitholders/Beneficial Owners whose names appear in the statement of beneficial owners maintained by the Depositories under dividend plan/option of the Scheme as on record date.

All unit holders under the dividend plan/option of the above mentioned scheme, whose names appear on the register of unit holders on the aforesaid record date, will be entitled to receive the dividend.

NOTICE CUM ADDENDUM NO. 105

Revision in Exit Load Structure of Nippon India Growth Fund w.e.f. February 02, 2021

Notice is hereby given that Nippon India Mutual Fund ("NIMF"/Nippon Life India Asset Management Limited ("NAM India") has decided to revise the Exit Load of the Nippon India Growth Fund w.e.f. February 02, 2021. The details of the same are as follows:

Existing Exit Load	Revised Exit Load
10% of the units allotted shall be redeemed without any exit load, on or before completion of 12 months from the date of allotment of units. Any redemption in excess of such limit in the first 12 months from the date of allotment shall be subject to the following exit load, Redemption of units would be done on First in First out Basis (FIFO):	1% if redeemed or switched out on or before completion of 1 month from the date of allotment of units. Nil, thereafter.
• 1% if redeemed or switched out on or before completion of 12 months from the date of allotment of units.	
• Nil, thereafter.	

W.E.F. October 01, 2012, Exit Load If charged to the scheme shall be credited to the scheme immediately net of goods and service tax, if any. The revision in exit load shall be applicable on a prospective basis to; (a) all the subscription transactions (including switch-in) processed with NAV of February 02, 2021 and thereafter, irrespective of receipt of application. (b) all the systematic transactions such as Systematic Investment Plan and Systematic Transfer Plan etc. where registrations / enrolments have been done on or after effective date.

This addendum forms an integral part of the Scheme Information Document / Key Information Memorandum of the Scheme. All the other terms and conditions of the aforesaid documents read with the addenda issued from time to time will remain unchanged.

For Nippon Life India Asset Management Limited
(Formerly known as Reliance Nippon Life Asset Management Limited)
(Asset Management Company for Nippon India Mutual Fund)
Sd/-

Mumbai
January 30, 2021

Authorised Signatory

Make even idle money work! Invest in Mutual Funds

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

ZEN TECHNOLOGIES LIMITED							
CIN: L72200TG1993PLC015939 B-42, Industrial Estate, Sanarathnagar, Hyderabad, Telangana-500018							
EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER 2020							
Sr. No.	PARTICULARS	STANDALONE			CONSOLIDATED		
		QUARTER ENDED 31-12-2020 (Unaudited)	9 MONTHS ENDED 31-12-2020 (Unaudited)	QUARTER ENDED 31-12-2019 (Unaudited)	QUARTER ENDED 31-12-2020 (Unaudited)	9 MONTHS ENDED 31-12-2019 (Unaudited)	QUARTER ENDED 31-12-2019 (Unaudited)
1	Total Revenue from Operations	1,587.51	3,065.60	3,236.27	1,657.12	3,308.71	3,298.77
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	362.94	376.95	1,379.20	269.28	193.85	1,291.71
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	362.94	376.95	1,379.20	269.28	193.85	1,291.71
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	268.86	277.12	1,047.83	175.20	94.02	977.17
5	Total Comprehensive Income for the period [Comprising Profit after tax and Other Comprehensive Income (after tax)]	268.86	277.12	1,047.83	177.41	122.77	971.25
6	Paid up Equity Share Capital (Rs. 1/- Per Equity Share)	795.10	795.10	771.60	795.10	795.10	771.60
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year ended)	20,378.03	20,378.03	17,320.35	19,469.21	19,469.21	16,495.52
8	Earnings Per Share (of Rs. 1/- each) (Not Annualised):						
	a) Basic	0.34	0.35	1.36	0.29	0.22	1.33
	b) Diluted	0.34	0.35	1.36	0.29	0.22	1.33

Notes: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulations 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on company's website at www.zentechnologies.com and the stock exchange's websites, www.nseindia.com and www.bseindia.com.

Statement of Deviation / Variation in utilisation of funds raised	
Name of listed entity	Zen Technologies Limited
Mode of Fund Raising	Preferential Issue of convertible warrants
Date of Raising Funds	1) 04/02/2019 - Date of allotment of warrants 2) 09/09/2020 - Date of allotment of equity shares upon conversion of warrants
Amount Raised (in Rs.)*	178,595,440/-
Report filed for Quarter ended	December 31, 2020
Monitoring Agency	Not Applicable
Monitoring Agency Name, if applicable	Not Applicable
Is there a Deviation / Variation in use of funds raised	No
If yes, whether the same is pursuant to change in terms of a contract or objects, which was approved by the shareholders	Not Applicable
If Yes: Date of shareholder Approval	Not Applicable
Explanation for the Deviation / Variation	Not Applicable
Comments of the Audit Committee after review	None
Comments of the auditors, if any	None

Objects for which funds have been raised and where there has been a deviation, in the following table						
ORIGINAL OBJECT	Modified Object, if any	Original Allocation	Modified allocation, if any	Funds Utilised	Amount of Deviation/ Variation for the quarter according to applicable object	Remarks if any
The proceeds of the preferential issue will be utilized towards research and development (R&D), potential acquisitions, export promotion, working capital, capital expenditure and general corporate purposes.	NA	178,595,440	NA	4,46,48,860	NONE	No Deviations or Variations

*Out of the total amount raised, 25% of the amount i.e., Rs. 4,46,48,860/- has been received by the company towards warrant subscription at the time of allotment of warrants. Further, the balance 75% of the amount i.e., Rs. 13,39,46,580/- has been received at the time of allotment of equity shares upon conversion of warrants.

Deviation or variation could mean:

(a) Deviation in the objects or purposes for which the funds have been raised or

(b) Deviation in the amount of funds actually utilized as against what was originally disclosed or

(c) Change in terms of a contract referred to in the fund raising document i.e. prospectus, letter of offer, etc

Note: Unutilised amounts of the issue as at December 31, 2020 have been temporarily deployed in fixed deposit with Scheduled Banks.

For and on behalf of the Board
Sd/-
Ashok Alluri
Chairman and Managing Director
DIN:00056050

Place: Hyderabad
Date : 30-01-2021



IDFC FIRST Bank Limited

Regd. Off.: KRM Tower, 7th Floor, No. 1, Harrington Road, Chetpet, Chennai - 600 031.
Corp. Office: Naman Chambers, C-32, G-Block, Bandra - Kurla Complex, Bandra (East), Mumbai - 400 051.
Website: www.idfcfirstbank.com, Email: bank.info@idfcbank.com
CIN: L65110TN2014PLC097792

Statement of Unaudited Financial Results for quarter and nine months ended December 31, 2020

(₹ in lakhs)

Sr. No.	Particulars	Standalone			Consolidated		
		Quarter ended 31.12.2020 (Unaudited)	Nine Months ended 31.12.2020 (Unaudited)	Quarter ended 31.12.2019 (Unaudited)	Quarter ended 31.12.2020 (Unaudited)	Nine Months ended 31.12.2020 (Unaudited)	Quarter ended 31.12.2019 (Unaudited)
1	Total Income from Operations	471172.25	1299708.88	467914.37	483586.08	1333039.69	477820.99
2	Net Profit before Tax, Exceptional and Extraordinary items	17871.36	43266.93	(162304.63)	19031.10	46350.79	(161353.52)
3	Net Profit before Tax and after Exceptional and Extraordinary items	17871.36	43266.93	(162304.63)	19031.10	46350.79	(161353.52)
4	Net Profit after Tax, Exceptional and Extraordinary items	12951.36	32446.93	(163889.34)	13715.14	34625.16	(163159.68)
5	Total Comprehensive Income for the period [comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)](refer note no. 1)	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.
6	Paid-up Equity Share Capital (Face value ₹ 10 per share)	567291.00	567291.00	478945.80	567291.00	567291.00	478945.80
7	Reserves excluding Revaluation Reserves as shown in the Audited Balance Sheet of previous year	1053269.74	1053269.74	1337758.50	1059361.99	1059361.99	1341768.74
8	Earnings Per Share for the period (Face value ₹ 10 per share) (for continuing and discontinued operations) - not annualized						
	- Basic (₹)	0.23	0.60	(3.43)	0.24	0.64	(3.41)
	- Diluted (₹)	0.23	0.59	(3.38)	0.24	0.63	(3.36)

Notes

- Information relating to Total Comprehensive Income and Other Comprehensive Income are not furnished as Indian Accounting Standards (Ind-AS) is not yet made applicable to Banks.
- The above is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of quarterly financial results are available on the Bank's website (www.idfcfirstbank.com) and on the Stock Exchange websites (www.nseindia.com and www.bseindia.com).

For and on behalf of the Board of Directors
of IDFC FIRST Bank Limited
Sd/-
V. Vaidyanathan
Managing Director & Chief Executive Officer

Date : January 30, 2021
Place : Mumbai

